

GJGS040016202026



આંક

દાખલ કર્યા તારીખ	૨૭	૦૪	૨૦૨૬
રજીસ્ટર્ડ કર્યા તારીખ	૨૭	૦૪	૨૦૨૬
ફેસલ કર્યા તારીખ	૦૧	૦૭	૨૦૨૬
સમયગાળો:	દિવસ	માસ	વર્ષ

મહેરબાન ઉનાના સેકન્ડ એડીશનલ સિનિયર સિવિલ જજ (શ્રી નીરજ કુમાર ચાદવ) સાહેબની કોર્ટ સમક્ષ મુ. ઉના, તા. ઉના, જી. ગીર સોમનાથ.

રે.દિ.મુ.નં. ૬૪/૨૦૨૬

વાદી: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
નવાબંદર બ્રાંચ,
મુ. નવાબંદર, તા. ઉના.

વિ ૩ બ્લ

પ્રતિવાદી: મેર સિરાજ હસન
ઉ.વ.આ. ૪૨,
રહે. ઇદગાહ રોડ, નવાબંદર,
તા. ઉના, જી. ગીર સોમનાથ.

દાવો:- સી.પી.સી. કલમ - ૯ મુજબ રૂ. ૧,૧૧,૯૭૫/- વસુલ લેવા અંગે.

વાદી તરફે વિ.વ.શ્રી - એન.એન. શિયાળ
પ્રતિવાદી તરફે - એકતરફી

- ઃ: ચુકા દો ઃ:-

(૧) આ કામના વાદીના દાવાની ટુંક હકીકત એવી છે કે, વાદી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નવાબંદર બ્રાંચ છે. પ્રતિવાદી ઉના તાલુકાના નવાબંદર ગામે રહે છે અને વાદી બેંકના PM VISHWAKARMA હેઠળના ખાતેદાર છે. પ્રતિવાદીએ વાદી બેંકમાં ફિશિંગ નેટ મેકરના ધંધા માટે ધિરાણ મેળવવા માટે તા. ૨૬/૧૨/૨૦૨૩ ના રોજ અરજી કરતા વાદી બેંકે અરજી મંજૂર કરતા પ્રતિવાદીએ તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ રૂ. ૧,૦૦,૦૦૦/- નું ધિરાણ મેળવેલ. પ્રતિવાદીએ આ માટે વાદીને લોનને લગતા દસ્તાવેજો જેવા કે લોન એગ્રીમેન્ટ કરાર વિગેરે દસ્તાવેજો લખી આપેલ હતા. પ્રતિવાદીએ હાઇપોથિકેશન તરીકે તેમના ફિશિંગ નેટ મેકરના ધંધાના સાધનો તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ લખી આપેલ. પ્રતિવાદીએ વાદી બેંક પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦/- ધિરાણ તરીકે લીધેલ છે. જે પૈકી હાલ પ્રતિવાદી પાસે રૂ. ૧,૧૧,૮૭૫/- બાકી લેણા નીકળે છે, જે રકમ ભરપાઈ કરવા પ્રતિવાદી જવાબદાર છે. આ ધિરાણ વાદી બેંકે પ્રતિવાદીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ધિરાણ પર ૧૧.૧૫ % ના વ્યાજના દરે વ્યાજ નક્કી કરીને આપેલ છે. વાદી બેંકને વ્યાજના નિયમ મુજબ થતો ફેરફારના ધોરણે પ્રતિવાદીને આપેલ ધિરાણની રકમ ઉપર વ્યાજમા વધારો કરવાનો હક્ક છે અને તે મુજબ વ્યાજ ચુકવવા પ્રતિવાદી બંધાયેલા છે. પ્રતિવાદી આ રકમ ભરવામાં અનિયમીત હોવાથી પ્રતિવાદીને તેઓએ પ્રતિવાદીએ તેઓના ધિરાણ પેટે બાકી નિકળતી રકમ ચડત વ્યાજ સાથે ભરી જવા અનેક વખત કહેવા છતા પ્રતિવાદી કશી જ દાદ આપતા નથી પરિણામે આ દાવો લાવવાની ફરજ પડેલ છે. વાદી બેંકના પ્રતિવાદી પાસે રૂ. ૧,૧૧,૮૭૫/- બાકી લેણા નિકળે છે. આ રકમમાં વ્યાજનો પણ સમાવેશ થઈ ગયેલ છે તેમજ દાવા તારીખ સુધીના વ્યાજનો સમાવેશ થઈ ગયેલ છે. જેથી વાદી તરફે હાલનો દાવો લાવી પ્રતિવાદી પાસેથી વાદી બેંકની લેણી રકમ રૂ. ૧,૧૧,૮૭૫/- દાવા તારીખથી વસુલ આવતા સુધી ૧૧.૧૫ % ચડત વ્યાજ સાથે પ્રતિવાદીની જાત તેમજ દરેક

પ્રકારની જંગમ તથા સ્થાવર મિલકત પરથી વસુલ મેળવવા તેમજ દાવાને આનુસંગિક મળી શકતી તમામ દાદ અપાવવા અરજ કરેલ છે.

(૨) હાલનો દાવો દાખલ થતા પ્રતિવાદીને હાજર થવા માટે પ્રોસેસ કરતા પ્રતિવાદીને પ્રોસેસ બજી જવા છતાં પ્રતિવાદી તરફે કોઈ હાજર ન રહેતા તા. ૧૫/૦૬/૨૦૨૬ ના રોજ પ્રતિવાદી વિરુદ્ધનું કામ એકતરફી ચલાવવાનો હુકમ કરવામાં આવેલ.

(૩) આ કામે વાદી તરફે પોતાના પક્ષ નિવેદનની હકીકતોને સમર્થન કરવા માટે નીચે મુજબના મૌખિક તથા દસ્તાવેજી પુરાવા રજુ રાખવામાં આવેલ છે.

- ઃ વાદી તરફે મૌખિક પુરાવો ઃ-

૧. આંક - ૦૮ થી વાદી બેંક તરફે નીરવ વિનુભાઈ વાઘેલાનું સરતપાસનું સોગંદનામું

- ઃ વાદી તરફે દસ્તાવેજી પુરાવાઓ ઃ-

૧. આંક - ૧૩ થી પ્રતિવાદીએ ધિરાણ મેળવવા અંગે વાદી બેંકમાં કરેલ અરજી

૨. આંક - ૧૪ થી પ્રતિવાદીએ વાદી બેંક જોગ કરી આપેલ એરેન્જમેન્ટ લેટર

૩. આંક - ૧૫ થી પ્રતિવાદીએ વાદી બેંક જોગ કરી આપેલ એરેન્જમેન્ટ લેટર

૪. આંક - ૧૬ થી પ્રતિવાદીએ કરી આપેલ લોન કમ હોઈપોથિકેશન એગ્રીમેન્ટ

૫. આંક - ૧૭ થી પ્રી સેન્કશન રીપોર્ટ

૬. આંક - ૧૮ થી એસેસમેન્ટ ફોર લોન

૭. આંક - ૧૯ થી પ્રતિવાદીએ લોન ડોક્યુમેન્ટની નકલો મળ્યા અંગેનું કરી આપેલ એકનોલોજમેન્ટ
૮. આંક - ૨૦ થી પ્રતિવાદીએ લોનની રકમ ડેબીટ કરવા માટે વાદીને કરી આપેલ ઓથોરીટી લેટર
૯. આંક - ૨૧ થી પ્રતિવાદીએ NeSL સાથે ઇન્ફોર્મેશન શેર કરવા વાદીને કરી આપેલ લેટર
૧૦. આંક - ૨૨ થી પ્રતિવાદીના CONSUMER BASE REPORT ની નકલ
૧૧. આંક - ૨૩ થી વાદીને સમજાવેલ FAQ's on IRACP Norms Annexure
૧૨. આંક - ૨૪ થી પ્રતિવાદીના UDYAM સર્ટિફિકેટની નકલ
૧૩. આંક - ૨૫ થી પ્રતિવાદીના PM VISHWAKARMA સર્ટિફિકેટની નકલ
૧૪. આંક - ૨૬ થી પ્રતિવાદીના આધારકાર્ડની નકલ
૧૫. આંક - ૨૭ થી પ્રતિવાદીના રેશનકાર્ડની નકલ
૧૬. આંક - ૨૮ થી પ્રતિવાદીને વકીલ મારફત આપેલ નોટીસ
૧૭. આંક - ૨૯ થી પ્રતિવાદીને વકીલ મારફત આપેલ નોટીસની વીન્ડો સ્લીપ

ત્યારબાદ આ કામે આંક - ૩૦ થી વાદી તરફે કલોઝીંગ પુરસીસ રજુ રાખી પુરાવો પુરો થયાનું જાહેર કરવામાં આવેલ છે.

-: પ્રતિવાદી તરફે મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ :-

આ કામના પ્રતિવાદીને પ્રતિવાદી વિરૂદ્ધ દાવો દાખલ થયેલ હોવાની નોટીસ કરી જાણ કરવામાં આવેલ હોવા છતાં આ કામના પ્રતિવાદી અદાલતમાં હાજર થયેલ ન હોય પ્રતિવાદી વિરૂદ્ધ કામ એકતરફી ચાલતું હોય આ કામના પ્રતિવાદી તરફે કોઈ પુરાવો નથી.

(જ) આ કામે આંક - ૬ થી નીચે મુજબના મુદ્દાઓ નક્કી કરવામાં આવેલ.

-ઃ મુદ્દા ઃ:-

1. Whether the plaintiff proves that an amount of Rs. 1,11,975/- is due from the defendants towards loan amount and the plaintiff is entitled to recover the same from the defendants on claimed?
2. Whether the suit is barred by the law of limitation?
3. Whether the plaintiff is entitled to get interest? If yes, at what rate?
4. What order and decree?

(પ) ઉપરોક્ત મુદ્દાઓનો મારા જવાબો નીચે મુજબ છે.

૧. હકારમાં
૨. હકારમાં
૩. હકારમાં, ૬ ટકા સાદા વ્યાજના દરે.
૪. આખરી હુકમ મુજબ

(૬) આ કામે વાદી તરફે વિ.વ. શ્રીની રજુઆત છે કે, આ કામે અદાલતે નક્કી કરેલ મુદ્દાઓ વાદી પક્ષે મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખી સાબિત કરવામાં આવેલ છે. આ કામે વાદી તરફે સોગંદ પર પુરાવો રજુ રાખી દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખવામાં આવેલ છે અને આ દસ્તાવેજો અદાલતના રેકર્ડમાં સાબિત કરવામાં આવેલ છે. આ કામે વાદીની હકીકતોને પડકારવા માટે વાદી તરફે કોઈ હાજર નથી. આ કામના વાદી તરફે પ્રતિવાદી વિરૂદ્ધ કરવામાં આવેલા આક્ષેપો આ હકીકતોએ સાબિત માનવા જોઈએ તેવી સ્થિતિ રહેલ છે. આ કામે પ્રતિવાદીએ વાદી બેંક પાસેથી લીધેલ ધિરાણને લગતા દસ્તાવેજો તથા લેણાની વસુલાત માટે પ્રતિવાદીને આપવામાં આવેલ નોટીસ અદાલતના રેકર્ડ પર રજુ કરવામાં આવેલ છે અને આ દસ્તાવેજો સાબિત

કરવામાં તેમજ વાદીએ દાવામાં માંગ્યા મુજબનું લેણું વસુલ મેળવવા હક્કદાર બનતા હોય તેવી હકીકતો સાબિત કરવામાં વાદી સફળ થાય છે તેવું માનવું જોઈએ તેમ જણાવી દાવો મંજૂર કરવા રજુઆત કરવામાં આવેલ છે.

આ કામે પ્રતિવાદી તરફેનું કામ એકતરફી ચાલતુ હોય પ્રતિવાદી તરફે કોઈ દલીલ કરવામાં આવેલ નથી.

- ઃ કારણો ઃ-

મુદ્દા નં. ૧ થી ૩ ના કારણોની ચર્ચા

(૭) આ કામે મુદ્દા નં. ૧ થી ૩ ના કારણો એકબીજા સાથે મળતા આવતા હોય પુનરાવર્તન તથા લંબાણ નિવારવાના હેતુથી આ મુદ્દાઓની ચર્ચા અત્રે એકસાથે કરવામાં આવે છે.

(૮) આ કામના વાદીએ કરેલ દાવાના અનુસંધાને પ્રતિવાદી હાજર રહેલ નથી અને પોતાનો કોઈ જવાબ રજુ કરેલ નથી. વધુમાં પ્રતિવાદીએ કોઈ જવાબ રજુ ના કરતા દાવો એક તરફી ચલાવવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામે આંક-૬ થી મુદ્દા કાઢવામાં આવેલ છે. એ મુદ્દાના અનુસંધાને વાદીએ પોતાનો પુરાવો રજુ કરેલ છે. આંક-૮ થી સરતપાસનું સોગંદનામું તથા પુરાવો રજુ કરેલ છે. સદર કામે પ્રતિવાદીને ઘણી તકો આપવા છતાં પ્રતિવાદી હાજર થયેલ ન હોય કે કોઈ પ્રોસીડીંગ કે રજુઆતો કરેલ ન હોય જેથી સદરહું કામ પ્રતિવાદી સામે એકતરફી ચલાવવાનો તેમજ પ્રોસીડીંગ આગળ ચલાવવાનો હુકમ કરવામાં આવેલ છે. તે આધારે સદરહું કેસની કાર્યવાહી આગળ ચલાવવાનો હુકમ કરવામાં આવેલ છે.

(૯) આ કામે વાદી દ્વારા જે દસ્તાવેજ પુરાવાનું લીસ્ટ રજુ કરવામાં આવેલ હતુ તે મુજબ આંક-૧૩ થી પ્રતિવાદીએ વાદી બેંકને આપેલ લોનની અરજી તથા આંક - ૧૪ થી ૧૯ સુધીના લોન અંગે જરૂરી દસ્તાવેજો રજુ કરેલ છે. જે જોતા આ કામના પ્રતિવાદીએ વાદી બેંક પાસેથી ધીરાણ મેળવેલ હોવાનું

જણાય આવે છે. વધુમાં આંક-૧૪ થી અરેજમેન્ટ લેટર તથા આંક-૧૬ થી હાઈપોથીકેશન કરાર રજુ થયેલ છે. આમ, ઉપરોક્ત તમામ દસ્તાવેજી પુરાવા જોતા આ કામના વાદી બેંકે પ્રતિવાદીને ધિરાણ કરેલ છે અને તે હકીકત પુરવાર થાય છે તેમજ તે હકીકતને પ્રતિવાદી દ્વારા પડકારેલ નથી.

(૧૦) આ કામના પ્રતિવાદીએ વાદીના દાવાના બચાવમાં પોતાનો કોઈ જવાબ રજુ કરેલ ન હોય જેથી વાદીનો દાવો મંજૂર કરવો તે ન્યાયોચીત છે. જ્યારે નક્કી કરેલ સમય મર્યાદામાં પક્ષકાર પોતાનો જવાબ રજુ કરવામાં નિષ્ફળ જાય તો અદાલત તે ફેસલ કરી શકે છે. તે પ્રમાણે હુકમનામું દોરવામાં આવે તો ન્યાયોચીત જણાય આવે છે. હાલના દાવામાં વાદી દ્વારા રજુ કરવામાં આવેલ દાવા બાબતે ધોરણસર સમન્સ બજવણી કરવા છતાં પણ પ્રતિવાદી હાજર રહેલ નથી કે પોતાનો બચાવ કરેલ નથી જેથી વાદીનો દાવો મંજૂર કરવો ન્યાયોચિત છે. વધુમાં આ કામના વાદી પોતાના દાવાની હકીકત અંશતઃ રીતે પુરવાર કરવામાં સફળ રહેલ હોય અને સદર કામે લોન મંજૂર કર્યાની તારીખ ધ્યાને લેવામાં આવે તો, તા. ૨૬/૧૨/૨૦૨૩ ના રોજ આપેલ છે જે ધ્યાને લેતા હાલનો દાવો તા. ૨૭/૦૪/૨૦૨૬ ના દાખલ કરેલ છે જેથી વાદીનો દાવો લીમીટેશનમાં છે.

(૧૧) અદાલતને સિવિલ પ્રોસિજર કોડની કલમ - ૩૪ ની જોગવાઈ મુજબ બાકી લેણી રકમ છ ટકા લેખે સાદા વ્યાજના દરે વસુલ મેળવવા દાદ આપવાની સત્તા મળેલ છે. તે કાયદાકીય જોગવાઈ ધ્યાને લેતા આ કામના વાદીને આ કામના પ્રતિવાદી પાસેથી બાકી નીકળતી રકમ રૂ. ૧,૧૧,૯૭૫/-, ૬ (છ) ટકા લેખે વ્યાજના દરે વસુલ મેળવવા હક્કદાર હોવાનું ઠરાવવામાં આવે તો ન્યાયનો હેતુ જળવાશે તેવું માનવાને કારણ જણાય આવે છે. આમ, વાદીનો દાવો લીમીટેશનમાં હોય તેથી મુદ્દા નં. ૧ થી ૨ નો જવાબ "હકારમાં" તથા મુદ્દા નં. ૩ નો જવાબ "અંશતઃહકાર" માં આપી મુદ્દા નં. ૪ અન્વયે નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

– ઃ: આખરી હુકમ ઃ:–

(૧) આ કામના વાદીનો હાલનો દાવો આથી અંશતઃ મંજૂર કરવાનો હુકમ કરવામાં આવે છે.

(૨) આ કામના પ્રતિવાદીએ વાદી બેંકની બાકી નિકળતી રકમ રૂ.૧,૧૧,૯૭૫/–અંકે રૂપિયા એક લાખ અગિયાર હજાર નવ સો પંચોતેર પુરાની રકમ દાવો દાખલ કર્યાની તારીખથી સદર રકમ વસુલ મળે ત્યાં સુધી વાર્ષિક ૬ % ના સાદા વ્યાજે વાદીને ચુકવી આપવા તેવો હુકમ કરવામાં આવે છે.

(૩) આ કામના વાદીને દાવાનો થયેલ ખર્ચ આ કામના પ્રતિવાદીએ ભોગવવો તેવો હુકમ કરવામાં આવે છે.

(૪) હુકમ મુજબ હુકમનામું દોરવું.

તા. ૦૧/૦૭/૨૦૨૬
સ્થળ. ઉના

(નીરજ કુમાર યાદવ)
સેકન્ડ એડી. સિનિયર સિવિલ જજ,
ઉના. તા. ઉના, જી. ગીર સોમનાથ
કોડ નં. GJ-01409